



Ministry of Health & Family Welfare  
Government of India

## Provisional Certificate for COVID-19 Vaccination - 1<sup>st</sup> Dose

### Beneficiary Details

Beneficiary Name / લાભાર્થી નું નામ	<b>Achchey Lal Chauhan</b>
Age / ઉંમર	<b>41</b>
Gender / લિંગ	<b>Male</b>
ID Verified / આઈ.ડી. ચકાસેલ	<b>Aadhaar # XXXXXXXXX1142</b>
Unique Health ID (UHID)	
Beneficiary Reference ID	<b>11158963185563</b>

### Vaccination Details

Vaccine Name / રસી નું નામ	<b>COVISHIELD</b>
Date of Dose / ડોઝની તારીખ	<b>24 Apr 2021 (Batch no. 4121Z053)</b>
Next due date / આગામી નિયત તારીખ	<b>Between 22 May 2021 and 19 Jun 2021</b>
Vaccinated by / રસી આપવા વાળા નું નામ	<b>Radha R. Solanki</b>
Vaccination at / રસીકરણ ની જગ્યા	<b>Demai PHC, Aravalli, Gujarat</b>




“દવા પણ, સાવધાની પણ  
Together, India will defeat  
COVID-19”

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

In case of any adverse events, kindly contact the nearest Public Health Center/  
Healthcare Worker/District Immunization Officer/State Helpline No. 1075

ડોઝ પણ અણધાર્યું સ્થિતિના સંજોગોમાં ટૂંપા કરીને નજીકના જાહેર આરોગ્ય કેન્દ્ર/ આરોગ્ય કર્મચારીઓ /  
જિલ્લા રસીકરણ અધિકારી/ રાજ્ય હેલ્પલાઇન નં. 1075

**COWIN**  
Winning Over COVID



This is a secure QR code. For further details, please visit  
<https://verify.cowin.gov.in>